

SEC/1505/2025 **By E-Filling** May 15, 2025

National Stock Exchange of India Limited

"Exchange Plaza",

C-1, Block G, Bandra- Kurla Complex,

Bandra (E),

Mumbai – 400 051.

Scrip Symbol: APARINDS

Kind Attn.: Listing Department

BSE Limited

Corporate Relations Department,

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street,

Fort,

Mumbai - 400 001. **Scrip Code : 532259**

Kind Attn.: Corporate Relationship Department

Subject: Publication of QR Code and Extract of Audited Financial Results for the Fourth Quarter and Financial Year ended March 31, 2025 in Newspapers.

Ref: Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time.

Dear Sir / Madam,

We refer to our Letter No. SEC/1405/2025 dated May 14, 2025 vide which we have submitted the Audited Financial Results (Standalone and Consolidated) of the Company for the Fourth Quarter and Financial Year ended March 31, 2025 (2024-25), we are now submitting herewith copies of the Extract of Audited Financial Results of the Company for the Fourth Quarter and Financial Year ended March 31, 2025, on Consolidated basis, published in Business Standard, English language newspaper and Vadodara Samachar, Regional language newspaper at Vadodara, Gujarat on May 15, 2025.

The above information is also available on the Company's website at www.apar.com.

Kindly take the above information on your record.

Thanking you,

Yours Faithfully,

For APAR Industries Limited

Sanjaya Kunder (Company Secretary)

Encl.: As above

ASBA*



Simple, Safe, Smart way to application - Make use of it.

UPI Now Available in ASBA For

Application Supported by Blocked Amount (ASBA) is better way of applying to issue by simple blocking the fund in the bank account, investors can avail the

same. For details, check the section on ASBA below. For Details on the ASBA and UPI process, please refer to the details given in ASBA form and Abridge Prospectus. Please refer to the section "Issue Procedure" beginning on page no.270 of the Prospectus. The process is also available on the website of National Stock Exchange of India Ltd. (www.nseindia.com), in General

Information Document. List of Banks Supporting UPI is also available on the

In terms of the SEBI Circular No. CIR/CFO/POLICYCELL/11/2015, dated November 10, 2015 all potential investors shall participate in the Issue only through an Application Supported by Blocked Amount (ASBA") process providing details about the bank account which will be blocked by the Self-Certified Syndicate Banks ("SCSBs") for the same. Further pursuant to SEBI circular bearing no. SEBIHO/CFD/DIL2/CIR/P/2019/76 dated June 28, 2019, for implementation of Phased II for the UPI facility, which is effective from July 01, 2019, all potential Bilders (except Anchor Investors) are required to mandatorily utilize the Application Supported by Blocked Amount (ASBA) process providing details of their respective ASBA accounts or UPI ID (in case of RIIs), in which the corresponding pplication Amounts will be blocked by the SCSBs or under the UPI Mechanism, as applicable. For details, please refer "Issue Procedure" beginning on page no

LEAD MANAGER (LM)

REGISTRAR TO THE ISSUE

COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER

website of SEBI (www.sebi.gov.in).



Corpwis Advisors Private Limited Telephone: +91 -22-49729990 Email: ipo.victory@corpwis.com

Contact Person: Mr. Nikunj Kanodia

Website: www.corpwis.com



Website: www.maashitla.com

Maashitla Securities Private Limited Telephone: 011-45121795 Email: Ipo@maashitla.com Contact Person: Mr. Mukul Agarwal



Bharti Rajput

Telephone: +91 9643108966 Email: compliance@victoryevindia.com Website: www.victoryevindia.com

Note: Investors may contact our Company Secretary and Compliance Officer and/or Registrar to Issue and/or Lead Manager, for any pre-issue or post-issue related queries, such as non-receipt of letters of allotment, credit of allotted Equity Shares in the respective beneficiary account or refund orders or nonreceipt of funds by electronic mode, etc. For all issue related queries and for redressal of complaints, investors may also write to the Lead Manager.

For and On Behalf of Victory Electric Vehicles International Limited

Place: Delhi

Sanjay Kumar Popl

Date: May 14, 2025 Victory Electric Vehicles International Limited is proposing, subject to applicable statutory and requirements, receipt of requisite approvals, market conditions and other considerations to make an initial Public Offering of its Equity Shares and has filed prospectus with Exchange. The Prospectus shall be available on the website of NSE at www.nseindia.com and the website of the LM at www.corpwis.com. Any potential Investor should not only rely on the Prospectus filed with exchange for making any investment decisions and should note that Investment in equity shares involves a high degree of risk and are also requested to refer to the section titled "Risk Factors" beginning on page no. 27 of the Prospectus for details of the same.

This announcement has been prepared for publication in India and not to be released or distributed in the United States. This announcement is not an offer to sell or a solicitation of any offer to buy Equity Shares of our Company in any other just the date States. The Equity Stares offered in the issue have not been an will not be registered under the LS Securities Act, 1933 US. Securities Act, 1933 US. Securities act, 1933 US. Securities laws in the United State securities laws in the United State securities laws as registered, not be registered under the LS securities laws. The Equity Shares have not been and will not be registered, listed or otherwise qualified in any other jurisdiction outside India and may not be offered or sold, and Bids may not be made by persons in any such jurisdiction, except in compliance with the applicable laws of such jurisdiction.

APAR Industries Limited

(CIN: L91110GJ1989PLC012802)

Registered Office: 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.

EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2025

				₹ in crore				
	Consolidated Results							
Particulars	Quarter	ended	Year end	ed				
	31.03.2025	31.03.2024	31.03.2025	31.03.2024				
	Audited	Audited	Audited	Audited				
Total Income from operations	5,209.76	4,455.11	18,581.21	16,152.98				
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	340.09	321.61	1,105.76	1,106.46				
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	340.03	321.62	1,105.64	1,105.85				
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	249.97	236.22	821.30	825.11				
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	263.03	212.45	829.47	806.14				
Equity Share Capital	40.17	40.17	40.17	40.17				
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as on 31st March			4,463.37	3,836.26				
Earnings Per Share (Face Value of ₹ 10/- each) (for continuing and discontinued operations) Basic and Diluted (in ₹)	62.23	60.97	204.47	212.10				
Notes:	02.20	00.01	201.17	212.10				

The said Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 14th May, 2025.

Additional information on Standalone financial results is as follows

Particulars	Quarter	ended	Year ended		
	31.03.2025	31.03.2024	31.03.2025	31.03.2024	
	Audited	Audited	Audited	Audited	
Total Income from Operations	4,980.63	4,225.59	17,552.26	15,109.28	
Profit before tax	332.47	322.30	1,072.82	1,099.41	
Profit for the period	244.27	238.44	793.67	823.28	
Total Comprehensive income (after tax)	258.05	214.16	798.56	802.33	

- The above is an extract of the detailed format of Statement of standalone and consolidated financial results filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of standalone and consolidated financial results are available on the Stock Exchange websites www.bseindia.com (Scrip Code - 532259) and www.nseindia.com (Scrip fy25.pdf
- The same can be accessed by scanning the QR Code provided below.

Place · Mumbai Date: 14th May, 2025



For APAR Industries Limited Sd/-Kushal N. Desai Chairman & Managing Director DIN: 00008084

Excel Industries Limited

CIN: L24200MH1960PLC011807 Regd. & Head Office:184-87, S.V. Road, Jogeshwari (West), Mumbai-400102. Tel.:+91-22-6646-4200

Email: investors@excelind.com, Website: http://www.excelind.co.in

STATEMENT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2025

	(NS. III EARIIS								
		Qu	Quarter Ended			Ended			
Sr. No.	Particulars	March 31, 2025	December 31, 2024	March 31, 2024	March 31, 2025	March 31, 2024			
			Unaudited	Unaudited	Audited	Audited			
1	Total income from operations	24,784.22	19,640.99	23,353.79	97,806.77	82,613.99			
2	Net Profit from ordinary activities (before Tax, Exceptional items)	1,629.01	840.84	890.23	11,294.14	2,265.04			
3	Net Profit from ordinary activities before Tax (After Exceptional items)	1,629.01	840.84	890.23	11,294.14	2,265.04			
4	Net Profit for the period after Tax (after Exceptional items)	1,240.66	620.21	667.38	8,531.34	1,701.00			
5	Total Comprehensive income for the period (Comprising Profit/ (loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	(4,363.46)	4,172.72	(1,500.86)	16,857.28	19,945.31			
6	Paid-up Equity Share Capital (Face value per share Rs.5/-)	628.53	628.53	628.53	628.53	628.53			
7	Earnings per share in Rs.(Face Value Rs. 5/- each) (not annualised) Basic & Diluted	9.87	4.93	5.31	67.87	13.53			

STATEMENT OF STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2025

					(Rs	. in Lakhs)	
		Qu	arter End	ed	Year Ended		
Sr. No.	Particulars		December 31, 2024	March 31, 2024	March 31, 2025	March 31, 2024	
		Unaudited	Unaudited	Unaudited	Audited	Audited	
1	Total income from operations	24,784.22	19,640.99	23,353.71	97,806.77	82,613.91	
2	Net Profit from ordinary activities (before Tax, Exceptional items)	1,528.21	865.30	953.81	11,090.70	2,019.49	
3	Net Profit from ordinary activities before Tax (After Exceptional items)	1,528.21	865.30	953.81	11,090.70	2,019.49	
4	Net Profit for the period after Tax (after Exceptional items)	1,137.41	639.62	730.53	8,349.82	1,510.71	
5	Total Comprehensive income for the period (Comprising Profit/ (loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax).	(3,548.67)	(3,271.14)	3,701.43	10,839.04	9,813.95	
6	Paid-up Equity Share Capital (Face value per share Rs.5/-)	628.53	628.53	628.53	628.53	628.53	
7	Earnings per share in Rs.(Face Value Rs. 5/- each) (not annualised) Basic & Diluted	9.05	5.09	5.81	66.42	12.02	



Place : Mumbai

Date: May 14, 2025

Note: The above is an extract of detailed format of the audited financial results for the Quarter and Year Ended March 31, 2025, filed with the Stock Exchange under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 The full format of the audited financial results for the Quarter and Year Ended March 31, 2025, is available on the Stock Exchanges websites www.bseindia.com and www.nseindia.com. The same is also available on the company's website www.excelind.co.in.

FOR EXCEL INDUSTRIES LIMITED

(ASHWIN C. SHROFF) **EXECUTIVE CHAIRMAN** DIN:00019952

INDO RAMA SYNTHETICS (INDIA) LIMITED

Registered Office: A-31, MIDC Industrial Area, Butibori - 441122, District Nagpur, Maharashtra. Corporate Office: Plot No. 53 & 54, Delhi Press Building, Phase-IV, Udyog Vihar, Gurugram -122015, Haryana. Tel.: 07104-663000 / 01, Email: investor-relations@indorama-ind.com, Website: www.indoramaindia.com, CIN: L17124MH1986PLC166615

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS (STANDALONE AND CONSOLIDATED) FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2025

	(₹ in Crore									(₹ in Crores)		
			Standalone					Consolidated				
			Quarter Ended		Year Ended		Quarter Ended			Year Ended		
Sr. No.	Particulars	March 31, 2025 (Audited)	December 31, 2024 (Unaudited)	March 31, 2024 (Audited)	March 31, 2025 (Audited)	March 31, 2024 (Audited)	March 31, 2025 (Audited)	December 31, 2024 (Unaudited)	March 31, 2024 (Audited)	March 31, 2025 (Audited)	March 31, 2024 (Audited)	
1	Total Income from Operations	1,136.75	1,074.41	866.48	3,989.94	3,716.76	1,221.23	1,168.10	905.56	4,287.96	3,880.07	
2	Net Profit/(Loss) for the period (before tax and exceptional items)	49.54	21.16	(15.77)	20.08	(141.66)	51.07	13.59	(40.48)	1.40	(203.44)	
3	Net Profit/(Loss) for the period before tax (after exceptional items) $ \\$	49.54	21.16	(15.77)	20.08	(141.66)	51.07	13.59	(40.48)	1.40	(203.44)	
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional items)	49.54	21.16	(15.77)	20.08	(141.66)	51.07	13.59	(40.48)	1.40	(203.44)	
	Total comprehensive income for the period (comprising profit/(loss)) for the period (after tax) and other comprehensive income (after tax)	48.09	21.27	(16.38)	18.74	(142.70)	49.61	13.76	(41.11)	0.11	(204.56)	
6	Paid-up Equity Share Capital (Face value of ₹10/- each)	261.11	261.11	261.11	261.11	261.11	261.11	261.11	261.11	261.11	261.11	

Notes

Other Equity

(a) Basic (in ₹)

(b) Diluted (in ₹)

Earnings per share (Face value of ₹10/- each) (Not Annualised)

1. The above is an extract of the detailed format of quarterly and yearly financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the Stock Exchange websites, viz. www.bseindia.com and www.nseindia.com. The same is also available on the Company's website, viz: www.indoramaindia.com.

(0.60)

(0.60)

191.85

0.77

0.77

173.11

(5.43)

(5.43)

1.96

1.96

0.53

0.53

(1.55)

(1.55)

- t. The above results, which are published in accordance with Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as modified by Circular No CIR/CFD/FAC/62/2016 dated July 5, 2016 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company, at their respective meeting held on May 13, 2025. The financial results of the Company have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India. Figures for the guarter ended March 31, 2025 and March 31, 2024 as reported in these financial results are the balancing figures between audited figures in respect of full financial year and the published year to date figures upto the third quarter of the respective financial year. Also, the figures upto the end of the third quarter were only reviewed and not subjected to audit.
- 3. Indorama Sustainable Polymers (India) Private Limited and Indorama Sustainable Polyester Yarns Privet Limited, Wholly Owned Subsidiaries of the Company, incorporated on December 17, 2022, are yet to commence operations
- 4. Figures for the previous periods have been regrouped and/or rearranged and/or reclassified wherever necessary to make them comparable with those of current periods.

0.81

0.81

1.90

1.90

Place: Gurugram Date: May 13, 2025

For and on Behalf of Board Indo Rama Synthetics (India) Limited

Om Prakash Lohia Chairman and Managing Director (DIN: 00206807) SHILCHAR TECHNOLOGIES LIMITED

107.10

0.05

0.05

106.99

(7.79)

(7.79)



Home Loan Centre Valsad (Code 64147). Ground Floor, Sai Leela Mall, Dharmapur Road, VALSAD-396 001. Email: sbi.64147@sbi.co.in

Whereas, The undersigned being the Authorised Officer of the State Bank of India RACPC VALSAD (64147) under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 05/03/2025 calling upon the Borrower Mr. Naran Bhojabhai Vankar to repay the amount mentioned in the notice being **Rs. 26, 41, 247/-** (Rupees Twenty Six Lakh Forty One Thousand Two Hundred Forty Seven Only) and interest from 05/03/2025 within 60 days from the date of receipt of the said notice

ofreceipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this **9th day of May of the year 2025**.

The Borrower / Guarantor in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the State Bank of India for an amount of **Rs.26.41,247**/-(Rupees Twenty Six Lakh Forty One Thousand Two Hundred Forty Seven Only) and

further interest from 05/03/2025 costs, etc. thereon

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Property

Property owned by: Mr. Naran Bhojabhai Vankar. All this piece and parcel of residential Row House no. 53/B having its Valsad Muncipal Property no 823/P/53/B admeasuring 86.76 Sq.Mts. Constructed on N.A land bearing SR. No. 268/2/53/B admeasuring 64.41 Sq.Mts. Known as Harivan Park of Village Abrama Tal. And dist. Valsad. Bounded: North- Plotno. 53-A, South- Plot no.53-C, East- Plot no.42, West- Internal Road.

Date: 09/05/2025

State Roak of India (PACSE) Valsad.

State Bank of India, (RACPC), Valsad. Place : Surat



STATE BANK Home Loan Centre Valsad (Code 64147), Shop No UG 1 to UG 5 & U12 to U15, G.F. Sai Leela Mall, Dharmapur Rd.,VALSAD-396 001. Email: sbi.64147@sbi.co.in

Notice u/s 13(2) of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002

Dear Sir(s), (1) Mr. Sanjaysinh Fathesinh Solanki, at (1) Flat no. B-2/05,

Ground Floor, Building no. B-2, "Jalaram Complex", Nr. Deep Complex, Naroli,
U.T. of Dadra and nagar haveli- Pin-396230 & (2) Flat no. B1/Flat no. 01,

Lateram Complex Kumphanyada, Naroli, Bio 206325 Availed Credit Ecclibios Jalaram Complex, Kumbharwad, Naroli- Pin-396235. Availed Credit Facilities from SBI Naroli Branch (15241) The Credit facilities are secured by mortgage

of the following assets. **Description of Property**

All the pieces and parcel of residential Flat no.05 admeasuring 500 Sq.Ft. equivalent to 46.46 sq.mtrs. on the ground floor of building B2, known as "JALARAM COMPLEX" constructed on the non agricultural land of survey no.1119/1 admeasuring 0 hector 95 are, survey no.1120/2 admeasuring 0 hector 30 are and survey no.1123 admeasuring 0 hector 20 are, totally admeasuring 1 hector 45 are of village naroli of the union territory of dadra and nagar haveli. North – Flat no.06, South – Society Internal Road, East – Entry & Passage, West –

You created mortgage of the above property. As you failed to adhere to the terms of the sanction (1) Home Loan A/c 32531361433, (2) Home Top up Loan A/c 35884764732 & (3) Suraksha loan A/C 32531383219 the accounts are now irregular and the debt has been classified as Non-performing asset on 04/01/2023, in accordance with the directives/guidelines relating to asset classification issued by the Reserve Bank of India consequent to the default committed by you in repayment of principal debt and interest thereon. Therefore, the bank hereby calls upon you u/s 13(2) of the SARFAESI Act, 2002 by issuing this Demand Notice dated 09/05/2025 as the notice sent to above mentioned address also. Your outstanding liabilities (in aggregate) due and owing to the bank is sum of Rs.6,25,221.31 (Rupees Six Lakh Twenty Five Thousand Two Hundred Twenty One and Thirty One Paisa Only) as on 05/05/2025, plus un applied interest w.e.f. 06/05/2025 and unrealized interest with further interest and incidental expenses costs etc. You are also liable to pay future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, cost, charges, etc within 60 days from the date of this notice falling which the undersigned may be constrained to initiate action under the said act to enforce the aforesaid

Date: 09/05/2025 Place : Surat

Sd/- Authorized Officer & Chief Manager, State Bank of India, Home Loan Centre, Valsad.



Regd.Office: Near Muval Sub Station, Padra Jambusar Highway Gavasad, Vadodara - 391430, Phone No +91 7624090901/2, Email: info@shilchar.com Website: shilchar.com CIN: L29308GJ1986PLC008387

NOTICE OF POSTAL BALLOT

Members are hereby informed that pursuant to the provisions of Section 108 and 110,

and other applicable provisions of the Companies Act, 2013, as amended (the "Act"), read together with the Companies (Management and Administration) Rules, 2014, as amended (the "Management Rules"), General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020,20/2020 dated May 5, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28,2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022, 11/2022 dated December 28, 2022, and 09/2023dated September 25, 2023 along with General Circular No. 9/2024 dated September 19, 2024, issued by the Ministry of Corporate Affairs, Government of India(the "MCA Circulars"), Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India. Regulation 44 of the Securities and Exchange Board of India(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the "LODR Regulations") and any other applicable law, rules and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), the approval of members of Shilchar Technologies Limited (the "Company") is sought for the following special resolutions by way of remote e-voting ("e-voting") process:

Sr. No. Description of Special Resolution

To consider and approve Re-Appointment of Mr. Rajesh Varma (DIN: 01034325) as a Non-Executive Independent Director of the Company. Pursuant to the MCA circulars, the Company has completed the dispatch of electronic copies of the Postal Ballot Notice along with the explanatory statement on May 12, 2025, through electronic mode to those Members whose email addresses are registered with the

Company / depository participant(s) as on May 09, 2025 ('Cut-off Date"). The said Notice is also available on the website of the Company: www.shilchar.com, the relevant section of the website of BSE Limited ('BSE"): www.bseindia.com and the website of Central Depository Services (India) Limited: www.evotingindia.com.

In accordance with the provisions of the MCA circulars, Members can vote only through e-voting process. The voting rights of the Members shall be reckoned on the basis of the equity shares of the Company held by them as on the Cut-off Date. Any person who is not a shareholder of the Company as on the Cut-off Date shall trea the Postal Ballot Notice for information purposes only.

The Company has engaged the services of Central Depository Services (India) Limited ("CDSL") for the purpose of providing e-voting facility to all its Members. The e-voting facility will be available during the following period:

Commencement of E-voting period | Thursday, May 15 2025, at 9:00 A.M. (IST) Conclusion of E-voting period Friday, June 13, 2025 at 5:00 P.M (IST) Friday, May 09, 2025 Cut-off date eligibility to vote The e-voting facility will be disabled by CDSL immediately after 5.00 p.m. IST on

Friday, June 13, 2025. Members who have not updated their e-mail address are requested to register the same in respect of shares held by them in electronic form with the Depository through their Depository participant and in respect of shares held in physical form by writing to Company's Registrar and Share Transfer Agent, MCS Share Transfer Agent Ltd either

by email to mcsltdbaroda@vahoo.com or by post to 10 Aram Apartment 12 Sampatrao Colony B/H Laxmi Hall Alkapuri, Vadodara, Gujarat, 390007. The Board has appointed CS Kashyap Shah (ICSI Membership No. FCS 7662) of

M/s. Kashyap Shah &Co., Practicing Company Secretaries, Vadodara as the Scrutinizer for conducting the Postal Ballot voting process through e-voting in a fair and transparent manner. The Scrutinizer will submit his report to the Chairman or any other person authorized

by the Chairman after the completion of scrutiny of the e-voting, and the result will be announced within 48 hours from the conclusion of e-voting i.e. 5.00 PM IST on Friday, June 13, 2025, and will also be displayed on the Company's website (https://shilchar.com/ent/investors-desk) and on the website of CDSL (https://www.evotingindia.com), and communicated to the stock exchanges depository, registrar and share transfer agent.

In case you have any queries or issues regarding e-voting, may refer the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com under help section or write an e-email to helpdesk.evoting@cdslindia.com or Contact Mr. RakeshDalvi, Sr. Manager at 25th Floor, A wing, marathon Futurex, mafatlal Mills compound, NM Joshi Marg, Lower Parel (E), Mumbai - 400 013; Contact Details 022-23058542/43 during working hours on all working days

For Shilchar Technologies Limited

Place: Gavasad, Vadodara Date: 15th May, 2025

Alay Jitendra Shah Managing Director

પ્રતાપનગર-છોટાઉદેપુર

ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરતા ખેલાડીઓ

રમતવીરોએ આર્ચરી, કુસ્તી અને કરાટેમાં ૧૪ જેટલા મેડલ મેળવ્યા



બોડેલી.તા.૧૪

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષ યોજાતા ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લઇ મેડલ મેળવી ખેલ મહાકુંભમાં ૩.૦૨૦૨૪- -૧ અબવ-૧૭ના ૭ (સાત) મેડલ ગોલ્ડ ૨૫માં છોટાઉદેપુર જિલ્લાનુ નામ રોશન -૪ સિલ્વર -૨ બ્રોન્ઝ -૧ એમાં કુલઃ-૧૪ એમ ૧૦મેડલ મેળવ્યા હતા.

કર્યુ હતુ. ખેલ મહાકુંભ ૩.૦માં ડાંગ ખાતે યોજાયેલ (૧) આર્ચરી સ્પર્ધામાં ભાઈઓ/ બહેનો અં-૧૪ ના ૫ (પાંચ) ગોલ્ડ મેડલઃ-૧, સિલ્વર મેડલઃ-૧ બ્રોન્ઝ મેડલઃ-૩ અં-૧૭ ના ૨ (બે) મેડલ ગોલ્ડ -૧ સિલ્વર

મેડલ મેળવ્યા હતા. આર્ચરી રમતમાં ટીમ ઇવેન્ટમાં અંડર ૧૪માં છોટાઉદેપુર ભાઈઓની ટીમ ચેમ્પિયન બની હતી. અબવ ૧૭ માં છોટાઉદેપુર ભાઈઓની ટીમ ચેમ્પિયન બની હતી. અંડર-૧૭ મિક્સ ટીમ ચેમ્પિન બની . અંડર-૧૭ ભાઈઓ ટીમ સિલ્વર મેળવ્યો હતો. અંડર-૧૪ બહેનોએ ત્રીજુ સ્થાન(બ્રોન્ઝ મેડલ), કુસ્તીની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દેવગઢ બારીયા(દાહોદ) ખાતે યોજાયલ હતી. આ કુસ્તી રમતમાં કુલ બોન્ઝ મેડલ ૨ મેળવ્યા. કરાટેની રાજ્ય કક્ષાની સ્પર્ધા આણંદ ખાતે યોજાયલ હતી જેમાં કરાટે રમતમાં કુલ બોન્ઝ મેડલઃ-૧ મેળવ્યો હતો.

સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ હિમતાનગર ખાતે માનસીક ક્ષતિગ્રસ્ત તમામ વયજૂથમાં રમાયેલ રમતામાં છોટાઉદેપુરના ખેલાડીઓએ પ ગોલ્ડ,૨ સિલ્વર, ૩ બ્રોન્ચ

ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં પણ લીમખેડા નગરમાં ૪ થી ૫ ડ્રોન આકાશમાં ઉડલાં જોવા મળતાં લોકોમાં કુતૃહલ સર્જાયું • લીમખેડા તા.૧૪ યૉકાવનારી છે. ડ્રોનની આ હિલયાલ કયા

રાજ્ય સરકાર દ્વારા ડ્રોન ઉડાડવા પર

સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, લીમખેડા નગરમાં મંગળવારે રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૩૦ ના સમયગાળા દરમિયાન ૪ થી પ ડ્રોન આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. આ ડ્રોન નગરની ચારે દિશામાં ફરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે, પરંતુ આ ડ્રોન કોણ ઉડાવી રહ્યું હતું અને તેનો હેતુ શું હતો, તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. આ ઘટના ની નગર જેનો દ્વારા તપાસની માંગ કરાઈ છે. લીમખેડામાં રાત્રે૧૦ઃ૩૦ થી ૧૧ઃ૩૦ ના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ૪-૫ ડ્રોન આકાશમાં ફરતાં જોવાયા મળ્યા હતા સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, રાત્રે ડ્રોનની હિલચાલ જોવા મળતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો રાજ્ય સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્રોન ઉડાડવા પર કડક પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં આવી ગેરકાયદેસર હરકતો રહે.

ઝાલોદ આરોગ્ય કચેરી ખાતે રક્તદાન

કેમ્પનું આચોજન કરવામાં આવ્યું

🔵 ઝાલોદ, તા.૧૪

આવ્યું હતું જેમાં યુવાનો અને મહિલાઓ દ્વારા સ્વૈચ્છીક રકતદાન

કરતા ૫૦ યુનીટ બ્લેડ કલેકશન કરવામાં આવ્યુ હતું. રક્તદાન એ જ

મહાદાન.. રક્તદાન થકી ઘણા લોકો પોતાનો જીવ બચાવવામાં આવે

છે. રક્ત દાતાઓ વગર સ્વાર્થે પોતાનું રક્ત દાન કરે છે. ત્યારે રક્તદાન

મહાદાન ની પંક્તિને સાર્થક કરતું સૂત્ર ઝાલોદ આરોગ્યતંત્રની કચેરી

ખાતે જોવા મળ્યું હતું. જેમાં આજરોજ તાલુકા આરોગ્ય કચેરી ઝાલોદ

દ્વારા ઝાલોદ ખાતે ઝાયડસ હોસ્પિટલ-દાહોદના સહયોગથી રકતદાન

કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝાલોદ શહેરના યુવાનો અને

મહિલાઓ દ્વારા સ્વૈચ્છીક રકતદાન કરવામાં આવેલ અને કુલ ૫૦ યુનીટ

બ્લડ કલેકશન કરવામાં આવ્યુ હતું.

ઝાલોદમાં આરોગ્ય કચેરી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં

ઉદ્દેશ્યથી થઈ રહી છે. તેની સાચી હકીકત બહાર લાવવી જરૂરી બની છે. કેટલાક સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી છે કે આ ડ્રોન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ, જેમ કે દેખરેખ કે અન્ય ગુનાહિત હેતુઓ માટે ઉડાવવામાં આવ્યા હોઈ શકે. આ ઘટનાએ સરકારના પ્રતિબંધના અમલીકરણ પર પણ સવાલો ઉભા કર્યા છે. નગરજનોનું કહેવું છે કે આવી હરકતો રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે. સ્થાનિકો દ્વારા પોલીસને આ મામલે ઝડપી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. ડ્રોન ઓપરેટરની ઓળખ અને તેમના હેતુની તપાસ થાય તો સાચી હકીકત બહાર આવી શકે છે. પોલીસ દ્વારા ત્વરિત

તપાસ થાય તેવી અપેક્ષા નગરજનો રાખે છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને નગરમાં શાંતિ જળવાઈ

બોડેલી ઓરસંગ નદીના બ્રિજના રોડની એંગલ બહાર દેખાતાં વાહનચાલકોને જોખમ

વાહન ચાલકોને જોખમ જોવા મળી રહ્યું છે બોડેલી ઓરસંગ

નદીના બ્રિજ નો લગભગ એક કિ. મી.લાંબો બ્રિજ નો

માર્ગ ખળખડધજ અને બ્રીજના રોડ પરની લોખંડની અંદર

પણ બહાર નીકળી ગઈ છે જેને લઈને વાહન ચાલકો

માટે જોખમ સેવાઈ રહ્યું છેબોડેલી ઓરસંગ નદીના પુલ

છે બોડેલી નજીક આવેલો ઓરસંગ નદી પરનો ઓવરબ્રીજ

પર મોટી સંખ્યામાં ફોરવીલ ટુ વીલ સહિત ભારી વાહનો

પસાર થાય છે તેવામાં આ બ્રિજ પરનો રોડ પરની લોખંડની

એંગલ પણ બહાર જોવા મળી રહી છે રાત દિવસ ધમધમતો

ઓરસંગ બ્રિજ જર્જરિત તો છે પણ તેની પેરાફીટ પણ તૂટી

જવાની આરે છે, ત્યારે વાહન ચાલકો માટે જોખમી બનેલા

ઓરસંગ બ્રિજની મરામત જરૂરી અથવા નવો બ્રિજ બનવો

બ્રિજ નો માર્ગ ખળખડધજ છે.તંત્ર દ્વારા થિંગડા પુરવાની કામગીરી બોડેલી ઓરસંગ નદીના બ્રિજ પર ની રોડની એંગલ જોવાતા ક્ચારેક થાય છે.

પશ્ચિમ રેલવે - વડોદરા ડિવિઝન

<u>હાલ્ટ એજન્ટોની નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવે છે.</u> સૂચના નં.C171/0/ADVT.VOL. VI તારીખ 13-05-2025 વડોદરા વિભાગના નીચેના સ્ટેશનો પર ટિકિટના વેચાણ માટે નીચે સૂચિબદ્ધ હોલ્ટ સ્ટેશનો પ અનરિઝર્વ્ડ ટિકિટ જારી કરવા માટે હોલ્ટ એજન્ટોની નિમણૂક માટે અરજીઓ મંગાવવા ઉપરના ખાડા વાહન ચાલકો માટે જોખમી જોવા મળી રહ્યા <u>આવે છે</u>: આણંદ-ગોધરા પ્રતાપનગર-છોટાઉદેપુર

નોંધ: ૧) લાયક ઉમેદવારોએ વેબસાઇટ www.wr.indianrailways.gov.in અપલોડ કરેલા દસ્તાવેજોમાં આપેલી વિગતો મુજબ અરજી કરવી. ૨) આ સૂચન ખખબારોમાં પ્રકાશિત થયાના 15 (પંદર) દિવસની અંદર અરજીઓ આ કચેરીમાં પહોંચ<u>ી</u> જવી જોઈએ. ૩) વિગતવાર માહિતી માટેનું સરનામું: સિનિયર ડિવિઝનલ કોમર્શિય જરૂરી તેવી લોગ માંગ જોવા મળી રહી છે બોડેલી થી સ્ટેચ્યુ મેનેજરની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, ડીઆરએમ ઓફિસ, પ્રતાપનગર, વડોદરા-390004.

ઓફ યુનિટી ને જોડતો બ્રિજ લગભગ એક કિ. મી.લાંબોં અમને લાહક કરોઃ f facebook.com/WesternRly • અમને ફોલો ક્રોઃ 🔀 twitter.com/

NKGSB Co-operative

<mark>રીકવરી ડીપાર્ટમેન્ટ</mark> : લક્ષ્મી સદન, ૩૬૧, વી.પી રોડ, ગીરગામ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : (૦૨૨) ૬૭૫૪૫૦૨૦/૨૧/૨૫/૪૦/૪૮/૭૩/૯૮ **E : recovery@nkgsb-bank.com મણીનગર શાખા** : ગોપી કૃષ્ણ કોમ્પ્લેક્ષ, અપસરા આરાધના પાસે, કાંકરીયા સર્કલ, મણીનગર, અમદાવાદ-૩૮૦૦૦૮ મો. ૮૬૫૫૬૯૯૪૩૮, Email id : maninagar117@nkgsb-bank.com

થુવાવી

ઈ-હરાજી વેચાણ નોટિસ (સરફેસી એક્ટ ૨૦૦૨ હેઠળ)

ધી સિક્યોરિટાઇગેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ને ધી સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ (૬) ની જોગવાઈ સાથે વંચાણે લેતાં હેઠળ સ્થાવર અસ્કથામતોના વેચાણની ઈ-હરાજી વેચાણ નોટિસ. બાથી જાહેર જનતાને સામાન્ય રીતે અને કોલમ મુજબના દેણદાર(રો), ગીરવેદાર(રો) અને જામીનદાર(રો)ને વિશેષ રૂપે નોટિસ આપવામાં આવે છે કે કોલમ મુજબની નીચે વર્ણન કરેલ સ્થાવર મિલકતો સિક્ચોર્ડ લેણદારને ગિરવે/ચાર્જ સિકયોર્ડ લેણદાર, કરેલ છે, એનો ભૌતિક કબજો એનકેજીએસબી કો.ઓપરેટીવ બેંક લિમિટેડ ના અધિકૃત અધિકારી દ્વારા લીધેલ છે જેનું ''જેમ છે ત્યાં છે'', ''જે છે તેમ'', અને ''જે ત્યાં આધારે છે'' અને કાંઈપણ આશ્રય વિના'' સંબંધિત રકમની વસુલાત માટે, એનકેજીએસબી કો.ઓપરેટીવ બેં લિમિટેડ(સિકયોર્ડ લેણદાર) ના કારણે સંબંધિત દેણદાર(રો)/ગીરવેદાર(રો)/જામીનદાર (રો) પાસેથી અહીં નીચે દર્શાવેલ છેઃ **હરાજી ૨૦.૦૦. ૧૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ થી** <mark>બપોેરે ૦૧.૦૦</mark> દરમિયાન હાથ ધરવામાં આવશે. વેબસાઈટ https://www.bankeauctions.com પર પાંચ મિનિટના અમર્યાદિત એક્સટેન્શન સાથે ઈસ્ક્રની ચુકવણી અને રિકવરી વિભાગ અથવા નજીકની કોઈપણ શાખામાં દસ્તાવેજો સબમિટ કરવાની **છેલ્લી તારીખ ૧૯.૦૬.૨૦૨૫ સાંજે ૪ઃ૦૦ વાગ્યા સુધીમાં છે.**

ઉદ્યાર લેનારાઓ /		એ) ડીમાન્ડ નોટીસની તારીખ,(૧૩)ર સરફેસી એક્ટ ૨૦૦૨ બી) તા.૩૦-૦૪-૨૦૨૫ના રોજ બાકી રકમ (રૂા.લાખમાં) સી) ભોોતિક કબજાની તારીખ		અર્નેસ્ટ મની ડીપોઝીટ રૂા.લાખમાં	બીડ વધારાની રક્મ રૂા. લાખમાં	બોજાની વિગતો સુરક્ષિત માટે જાણીતા લેણદાર બેંક
૧. શ્રી કલ્પેશભાઈ જે ૨. શ્રીમતી નીનાબેન ૩. શ્રીમતી મધુબેન ર ૪. હાર્દિક ગીરીશભા	કલ્પેશ ઠક્કર મેસ રાઠોડ	એ) ૧૩-૦૮-૨૦૨૪ બી) રૂા. ૬૯.૧૪ સી) ૦૨-૦૩-૨૦૨૫	∠ €.€0	८. €€		કોઈપણ નહીં ચુકવાયેલ મિલકતના લેણાં અન્ય કોઈપણ ઉપયોગિતા બિલ બોજા અધિકૃત અધિકારી જાણતો નથી

ગીરો મુકેલ મિલકતોનું વર્ણનઃ ટેનામેન્ટ નં. સી/૪૯, પૂજા પાર્ક સોસાયટી, વડોદરા મ્યુનિસિપલ વોર્ડ નં. ૯ અને સર્વે નં. ૦૯-૦૪-૦૩૮-૦૦૧-૦૯૫-૦૨૦ સર્વે નં. ૨૩૪ ર૩૬/૧, ર૩૬/૨, ર૩૬/૩, ર૩૭, ૨૪૧ સીટી સર્વે નં. ૨૧૩, ૨૬૦, ૨૬૧ ક્ષ ૨૬૩, ટી.પી. નં. ૫ અને એફ.પી. નં. ૨૧૩/પૈકી, ૨૬૦, ૨૬૧ અને ૨૬૩ બીનખેતીની જમીન ોના પર આવેલ સ્કીમ કે જે ''પૂજા પાર્ક સોસાયટી'' તરીકે જાણીતી છે. જમીનનો વિસ્તાર ૧૦૮.૦૦ ચોરસ મીટર તેમજ આંતરિક રસ્તો અને કોમન પ્લોટ જેમાં ૧૪.૭૫ ચોરસ મીટર જમીનનો સમાવેશ થાય છે. કુલ જમીનનો વિસ્તાર ૧૨૨.૭૫ ચોરસ મીટર છે. બાંધકામ વિસ્તાર ૨૫.૪૪ ચોરસ મીટર છે (મ્યુનિસિપલ ટેક્સ બિલ ૮૪.૬૭ ચોરસ મીટર મુજબ) મોજે સવાદ, તાલુકા વડોદરા શહેર (પૂર્વ), જિલ્લો વડોદરા, સબ રજિસ્ટ્રાર ઓફિસ વડોદરા (બાપોદ-પ), જિલ્લો વડોદરા, ગુજરાત અને નીચે મુજબ સીમા ધરાવે છેઃ પૂર્વઃ ૧૩.પ૦ મીટર ટી. પી. રોડ, પશ્ચિમઃ ટેનામેન્ટ ને. સી/૫૦, ઉત્તરઃ એફ. પી. નંબર ૨૬૨, દક્ષિણઃ ૬.૦૦ મીટર રોડ

નિરીક્ષણ માટે ડિમાન્ડ સંપર્કઃ શ્રી સ્વરૂપ વાક્ડે મો. ७၄၄၄૯૪૮૨૩૯

ઓનલાઈન હરાજી સી૧ ઈન્ડીયા (પ્રા) લિમિટેડ વેબ પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવશે https://www.bankeauctions.com વેચાણના નિયમો અને શરત https://www.bankeauctions.com તેમજ બેકોની વેબસાઈટ https://www.nkgsb-bank.com પર દર્શાવવામાં આવશે. બિડરોને તેમની બિડ દસ્તાવેજી પુરાવાઓ સાથે https://www.bankeauctions.com પર અપલોડ કરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે જો બિડર્સને સહાયની જરૂર હોય તો તેઓ **શ્રી ભાવિક પંડચા - ૮૮૬૬૬૮૨૯૩७ અથવ સપોર્ટ મોબાઇલ પર ટેક્નિકલ સપોર્ટ માટે સંપર્ક કરી શકે છે**. સી૧ ઈન્ડીયા (પ્રા) લિમિટેડ ના નંબર ૭૨૯૧૯૮૧૧૨૪/૨૫/૨૬. ભૌતિક દસ્તાવેજો ને સબમિટ/પોસ્ટ કરવા માટે એનકેજીએસબી કો- ઓપબેંક લિ., ડેપ્યુટી જનરલ મેનેજર-રીકવરી, લક્ષ્મી સદન, ૩૬૧, વી.પી. રોડ, ગીરગામ, મુંબઈ-૪૦૦૦૦૪. રીકવરીની માહીતી ecovery@nkgsb-bank.com પર મોકલી આપેવી

સરફેસી એક્ટ, ૨૦૦૨ હેઠળ વેદ્યાનિક ૩૦ દિવસની વેચાણ નોટીસ

સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ની જોગવાઈ પ્રત્યે ઉધાર લેનારાઓ અને ગીરવેદારોનું મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે. સ્થળ - મુંબઈ, તારીખ : ૧૫-૦૫-૨૦૨૫ સહી/- અધિકૃત અધિકારી,એનકેજીએસબી કો-ઓપ બેંક લિ

EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS

FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2025

31.03.2025

Audited

5.209.76

340.09

340.03

40.17

APAR Industries Limited

(CIN: L91110GJ1989PLC012802)

Registered Office: 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.

31.03.2024

Audited

4,455.11

321.61

321.62

212.45

40.17

Consolidated Results

31.03.2025

Audited

18,581.21

1,105.76

1.105.64

40.17

4.463.37

204.47

દાહોદ જિલ્લા કલેક્ટરની લીમખેડા મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત

દાખલા માટે ભીડ જોઈ વિદ્યાર્થીઓ અને અરજદારોની સુવિધા માટે કડક સૂચનાઓ

દાહોદ જિલ્લા કલેક્ટરની લીમખેડા મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત, વિદ્યાર્થીઓ અને અરજદારોની સુવિધા માટે કડક સૂચનાઓ , જ્યારે ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો બાદ આવક-જાતિના દાખલા માટે ઉમટતી ભીડને ધ્યાને લઈ કલેક્ટર યોગેશ નિરગુડે ઝડપી અને ચોક્કસ કામગીરીના આદેશ આપ્યા હતા.દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે આજે લીમખેડા મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લઈને વહીવટી કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન લીમખેડા પ્રાંત િનકાલ થાય અને અરજદારોને ધક્કા ન ખાવા પડે.

અધિકારી વાય. કે. વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના પરિણામો જાહેર થયા બાદ આવક, જાતિ અને ઓબીસીના દાખલા મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ મામલતદાર કચેરીમાં ઉમટી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ કલેક્ટરે અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થિત આયોજનની સૂચના આપી.મુંલાકાત દરમિયાન કલેક્ટરે ઈ-ધરા કેન્દ્ર, એટીવીટી સેન્ટર, પુરવઠા વિભાગ અને મહેસૂલ શાખાની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. તેમણે

ભૂતખેડી ગ્રામ પંચાયતમાં સ્ટોન બંધના વિકાસનાં કામો શરૂ કરાતાં ચર્ચાનો વિષય

તાજેતરમાં જ દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારિયા તાલુકા મા મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ થતા અનેક ગેરિરીતિ બહાર આવતા મોટા માથાઓના નામ ઉથળતા પોલીસ ફરિયાદ દાખલ થવા પામી હતી. ત્યારે સિંગવડ તાલુકાના ભુતખેડી ગ્રામ પંચાયત માં કેટલાક જ સર્વે નંબરો માં મનરેગા વિભાગની યોજના માં નવીન સ્ટોનબંધ ની બાંધકામ ની કામગીરી શરૂ કરાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે આ બાબતે સિંગવડ તાલુકા વિકાસ અધિકારી ને પૂછપરછ કરતા સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મેહુલ ભગોરા એ જણાવ્યું કે મનરેગા યોજનામાં હાલ કોઈપણ સ્ટોન બંધ જેવી કોઈ પણ યોજનાની વહીવટી મંજૂરી આપવામાં આવી નથી જ્યારે તાજેતરમાં મનરેગા યોજનામાં માત્ર નવીન કુવાની જ યોજના અમલમાં આપવામાં આવી છે ત્યારે ભુતખેડી ગ્રામ પંચાયત માં ગામના કેટલા આગેવાનોએ પ્રાથમિક તપાસ હાથ ધરતા એક જ દિવસમાં અલગ -અલગ સર્વે નંબરમાં ૭ જેટલા સ્ટોન બંધ માત્ર એક જ

દિવસમાં કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સ્ટોન બંધ ની કામગીરી ભૂતકાળ ના વર્ષોની હોઈ શકે હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે છે .જ્યારે સ્ટોન બંધમાં વપરાતા માલ સામાન પણ મનરેગા વિભાગના જ કેટલાક કર્મચારી અને એજન્સી ચલાવતા માલિક દ્વારા આપવામાં આવતા વહીવટી તંત્ર ની કથીત મિલી ભગત સાબિત થતી હોવાનું ગ્રામજનો સુર પુરાવ્યો હતો.

ગ્રામજનોએ ભુતખેડી ગ્રામ પંચાયતમાં વીતેલા વર્ષોમાં સરકારી ચોપડે એક જ સર્વે નંબરમાં ૬- ૬ થી વધારે જેટલા સ્ટોનમાં બતાવી લાખો રૂપિયાની મતાની સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં હાથ ધરાતા મામલો તપાસનો વિષય બન્યો છે તાલુકા પંચાયત વિકાસ અધિકારી દ્વારા બાબતે તપાસ કરવામાં આવે તો યોગ્ય ન્યાયિક તપાસ હાથ ધરે તો આવનાર સમયમાં પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે.

વિવિધ ઇલેક્ટ્રિકલ કાર્ય

ટેન્ડર સં : EL/TRD/Tender/25-26/01-R ભારતના રાષ્ટ્રપતિ મટે અને તેમના વતી ડિવિઝનલ રેલવે મેનેજર (ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન) પશ્ચિમ રેલવે, પ્રતાપનગર વડોદરા - 390 004 નીચેના કામ માટે ટેન્ડરો આમંત્રિત કરે છે **ટેન્ડર સં :** EL/ TRD Tender/25-26/01-R **કામનું નામ :** વડોદરા વિભાગના સુરત-ગોધરા અને વડોદરા ગેરતપુર વિભાગોમાં હાલના 1x25 kV AC OHE સિસ્ટમને 2x25 kV AC OHE સિસ્ટમમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ફિટિંગ સાથે ફીડર વાયર, એરિયલ અર્થ કંડક્ટર (AEC) અને બરીડ અર્થ કંડક્ટર (BEC) ની જોગવાઈ. <mark>કામનો</mark> અંદાજિત ખર્ચ (રૂ.માં) : ₹134608540/-બિડ સિક્યોરિટી (રૂ.માં) : ₹823100/-ટેન્ડર દસ્તાવેજો કિંમત અને સમાપ્તિ અવધિ : સમાપ્તિ અવધિ 18 મહિના ટેન્ડર સમાપ્તિ તારીખ : ટેન્ડર સમાપ્તિ તારીખ 16/06/2025 અને સમાપ્તિ સમય તે જ તારીખે 15-00 કલાકે વેબપેજની વિગતો અને સૂચનાનું સ્થાન જ્યાં સંપૂર્ણ વિગતો જોઈ શકાશે અને માહિતી માટે ઓફિસનું સરનામું : ડિવિઝનલ રેલવે મેનેજર (ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન) પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, વડોદરા - 390 004 **વેબસાઇટ @**

www.ireps.gov.in

અમને લાશક કરોઃ 🚹 facebook.com/WesternR

હાજર અરજદારો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ સાંભળી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો. લીમખેડા મામલતદાર અનિલ વસાવા અને પ્રાંત અધિકારી વાય. કે. વાઘેલાની હાજરીમાં કલેક્ટરે મામલતદાર અને નાયબ મામલતદારોને જરૂરી સૂચનાઓ આપી.કલેક્ટર નિરગુડે ખાસ ભાર મૂક્યો કે રેવન્યુ તલાટીઓ સમયસર લોકોને મળી શકે અને અરજદારોની કામગીરી નિયત સમયમર્યાદામાં ચોકસાઈપૂર્વક પૂર્ણ થાય. આવક, જાતિ અને જમીનની નોંધોની અરજીઓનો ઝડપથી



શિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડ

રજી. કચેરી : મુવાલ સબ સ્ટેશન પાસે, પાદરા જંબુસર હાઇવે, ગવાસાડ, વડોદરા - ૩૯૧૪૩૦, ફોન નં.: +૯૧ હ૬૨૪૦૯૦૯૦૧/૨ સીઆઈએન : L29308GJ1986PLC008387

टपास भतदाननी सूचना

આથી સદસ્યોને સચના આપવામાં આવે છે કે કંપનીઝ એક્ટ ૨૦૧૩ની કલમ ૧૦૮ અને ૧૧૦ની જોગવાઈઓ (સુધારેલો એક્ટ) ને કંપનીઝ (મેનેજમેંટ એન્ડ એડમીનીસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ (સુધારેલો મેનેજર્મેટ) રૂલ્સની સાથે વાંચતા અને સામાન્ય પરિપત્રો ક્રમાંક ૧૪ $^{\prime}/$ ૨૦૨૦ તા.૮મી એપ્રિલ, ૨૦૨૦, ૧૭/૨૦૨૦ તા.૧૩ એપ્રિલ, ૨૦૨૦, ૨૦/૨૦૨૦ તા.૫મી મે, ૨૦૨૦, ૨૨/૨૦૨૦, તા.૧૫ જુન ૨૦૨૦, ૩૩/૨૦૨૦ તા.૨૮મી સપ્ટેમ્બર. ૨૦૨૦. ૩૯/૨૦૨૦ તા.૩૧ કિસેમ્બર, ૨૦૨૦, ૧૦/૨૦૨૧ તા.૨૩ જુન, ૨૦૨૧, ૨૦/૨૦૨૧ તા.૦૮ કિસેમ્બર, ૨૦૨૧, ૩/૨૦૨૨, તા.૫મી મે, ૨૦૨૨, ૧૧/૨૦૨૨ તા.૨૮ કિસેમ્બર, ૨૦૨૨, અને ૯/૨૦૨૩ તા. ૧૫મી સપ્ટેમ્બર, ૧૦૧૩ સાથે સામાન્ય પરિપત્રો ક્રમાંક ૦૯/૧૦૧૪ તા. ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૪ જે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંગાલય (ધી એમસીએ સર્કચુલર) દ્વારા બહાર પાડવામાં આવ્યા તે, તથા ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેકેટરીઝ ઓફ ઈન્ડિયાના સાધારણ બેઠકોને લગતા સેકેટરીઝ ધારાધોરણો તેમજ સીક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લીર્સ્ટીગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીક્વાયરમેંટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ સુધારેલા એલઓડીઆ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન-૪૪ તથા અન્ય કોઈપણ કાયદો, નિયમો અને નિયમનો જે લાગુ પડતા હોય (કોઈપણ વેદ્યાનિક સઘારા(ઓ) અથવા રીએન્કટમેંટ જે જેતે સમય માટે અમલમાં હોય આ તમામની સંયુક્ત જોગવાઈઓ हेઠળ નીચે જણાવેલા ખાસ ઠરાવો દ્વારા સિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડ (ઘી કંપની)ના સદસ્યોની સંમતિ રીમોટ ઈ-વોટીંગ દ્વારા માંગવામાં આવે છે.

અ. નં. વિશેષ ઠરાવોનું વર્ણન

કંપનીના બિન-કાર્ચકારી સ્વતંત્ર ડિરેક્ટર તરીકે શ્રી રાજેશ વર્મા (DIN: 01034325) પુન: નિયુક્તિ પર વિચારણા અને મંજૂરી એમસીએના પરિપત્ર પ્રમાણે, કંપનીએ તા.૧૨મી મે, ૨૦૨૫ના રોજ સમજુતીના નિવેદન સાથે રપાલ મત પત્રકોની વિજાણુ નકલોની, એવા સભાસદો કે જેમના ઈ-મેઇલ સરનામાં કંપની/ડિપોજીટરી પાર્ટીસીપન્ટસ પાસે તા.૦૯મી મે, ૨૦૨૫ સુધીમાં નોંઘાયેલ છે (કટ ઓફ કેટ)

વિજાણુ માધ્યમથી રવાનગી પૂરી કરી છે. ઉપરોક્ત સુચના કંપનીની વેબસાઈટ www.shilchar.com બી.એસ.ઈ. લિમિટેડની(બીએસઈ)ની વેબસાઈટ <u>www.bseindia.com</u> અને સેન્ટ્રલ કિપોજીટરી સર્વિસીસ(ઈન્કિયા) લિમિટેકની

વેબસાઈટ <u>www.evotingindia.com</u> પર ઉપલબ્ધ છે. એમસીએ પરિપત્રોની જોગવાઈઓ અનુસાર સભાસદો ફક્ત ઈ-વોટીંગ પ્રક્રિયા हેઠળ જ મત આપી શકે છે. સભાસદનો મત અધિકાર કટ ઓફ કેટની તારીખે તેમણે ધારણ કરેલા કંપનીના શેરના આધારે નક્કી થશે. જે વ્યક્તિ કટ ઓફ ડેટની તારીખે કંપનીનો સભાસદ નથી, તેણે મળેલી ટપાલ મત સૂચનાને માત્ર જાણકારી માટેની સૂચના ગણવી.

પનીએ તેના તમામ સભાસદોને ઈ-વોટીંગની સવિદ્યા ઉપલબ્ધ કરાવવા સેન્ટલ ડિપોર્ સર્વિસીસ (ઈન્ડિયા) (સીડીએસએલ) ની સેવાઓ લીઘી છે. નીચેના સમયગાળા દરમિયાન ઈ-વોટીંગ કરી શકાશે

ગુરૂવાર, તા.૧૫મી મે, ૨૦૨૫ ના રોજ સવારન ઈ-વોટીંગના સમયગાળાની શરૂઆત e.oo વાગ્યાથી (આઈએસટી) ઈ-વોટીંગના સમયગાળાનું સમાપન શુક્રવાર, તા.૧૩મી જૂન, ૨૦૨૫ ના રોજ સાંજે ૫.૦૦ વાગે (આઈએસટી) મત આપવા માટેની કટ ઓફ ડેટ પાત્રતા શુક્રવાર, તા.૦૯મી મે, ૨૦૨૫

સીડીએસએલ હ્રારા શુક્રવાર, ૧૩મી જૂન, ૨૦૨૫ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યા પછી તુરંત જ ઇ-વોટીંગની સુવિધા નિસ્ક્રીય કરવામાં આવશે.

એવા સદસ્યો જેમણે પોતાના ઈ-મેઈલ સરનામા અદ્યતન કરાવ્યા નથી, તેઓનો ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં શેર ધરાવતા હોય તો તેમના ડિપોજીટરી પાર્ટીસીપન્ટસ પાસે અને જો ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવતા હોય તો કંપનીના રજસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ, એમસીએસ શેર ટ્રાન્સફર એજન્ટ લિમિટેક પાસે તે અધતન કરાવી લેવા વિનંતી છે. તેના માટે mcsltdbaroda@yahoo.com ને ઈમેઈલ મોકલવો અથવા ૧૦, આરામ એપાર્ટમેંટ, ૧૨ સંપતરાવ કોલોની, લક્ષ્મી હોલની પાછળ, અલકાપરી, વડોદરા, ગજરાત - ૩૯૦૦૦૭ ના સરનામે ટપાલ મોકલવી.

સીએસ કશ્ચપ શાહ (આઈસીએસઆઈ સદસ્ચતા ક્રમાંક એફસીએસ ૭૬૬૨) જેઓ મે/સ કશ્ચપ શાહ એન્ડ કંપની, પ્રેક્ટીસીંગ કંપની સેક્રેટરીઝ, વડોદરા સાથે જોડાયેલા છે, તેમની સ્ક્રુટીનાઈઝર તરીકે નિયક્તિ કરી છે. સ્ક્રટીનાઈઝર, ઈ-વોટીંગની સ્ક્રટીની પૂરી કર્યા પછી તેમનો રીપોર્ટ ચેરમેનને અથવા ચેરમેન દ્વાર

કંપનીએ ઈ-વોટીંગ હ્રારા ટપાલ મતદાન પ્રક્રિયાને તટસ્થ અને પારદર્શક રીતે હાથ ઘરવા માટે

અધિકૃત અન્ય કોઈ વ્યક્તિને આપશે અને ઈ-વોટીંગના સમાપન એટલે કે શુક્રવાર, ૧૩મી જૂન, ૨૦૨૫ની સાંજના ૫.૦૦ વાગ્યાથી ૪૮ કલાકની મુદતમાં પરિણામ જાહેર કરવામાં આવશે. અ પરિણામ કંપનીની વેબસાઈટ (https://shilchar.com/ent/investors-desk) સીડીએસએલની વેબસાઈટ (https://www.evotingindia.com) પર મૂકવામાં આવશે અને સ્ટોક એક્સચેન્જસ, ડિપોજીટરી રજસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટને જણાવવમાં આવશે.

જો ઈ-વોટીંગની બાબબતમાં તમને કોઈ પ્રશ્ન હોય કે વિવાદ હોય તો તમે વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુએસ) તેમજ ઈ-વોટીંગ મેન્યુઅલ જે <u>www.evotingindia.com</u> હેલ્પ સેક્શનમાં પર ઉપલબ્ધ છે તે જોઈ શકો છો અથવા આ બાબતમાં helpdesk.evoting@cdslindia.com ને ઈમેઈલ કરી શકો છો અથવા શ્રી રાકેશ દળવી, સીનીચટ મેનેજરનો ચપમો માળ, એ-વીંગ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મીલ્સ કમ્પાઉન્ડ, એનએમ જોષી માર્ગ, લોઅર પરેલ (ઈ). મુંબઈ-૪૦૦૦૧૩ નો, ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩ પર કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન સંપર્ક કરી શકો છો.

શિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડ વતી

સ્થળ : ગવાસદ, વડોદરા અલચ જીતેન્દ્ર શાહ તા.: ૧૫મી મે. ૨૦૨૫ મેનેજીંગ ડીરેક્ટર



વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લીમીટેડ

CIN: L31100GJ1967PLC001437 Regd. ઓફ્સિઃ મકરપુરા, વડોદરા-૩૯૦૦૧૪, ગુજરાત (ભારત) ફોન: +91 265 6141403/ 6141480/3041480 ઇ-મેઇલ : voltamp@voltamptransformers.com, વેળસાઇટ : www.voltamptransformers.com

શેરધારકોને સૂચના

કંપનીના ઈકિવટી શેરનું ટ્રાન્સફર ઇન્વેસ્ટર અને પ્રોટેક્શન ફંડ

(IEPF) **ખાતામાં** શેરધારકોને આથી જાણ કરવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ અને રોકાણકાર

શિક્ષણ અને સુરક્ષા ભંડોળ સત્તામંડળ (એકાઉન્ટિંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રિફંડ) નિયમો, ૨૦૧૬ ("નિયમો") ની જોગવાઈઓ અનુસાર, કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ૭ સપ્ટેમ્બર, ૨૦૧૬ થી અમલમાં મુકવામાં આવેલ સુધારેલા, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે જાહેર કરાયેલ અંતિમ ડિવિડન્ડ, જે સાત વર્ષ સુધી દાવો ન કરાયેલ રહ્યું હતું, તે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ પછી IEPF માં જમા કરવામાં આવશે. જે સંબંધિત શેર પર સતત સાત વર્ષ સુધી દાવો ન કરાયેલ હતો તે પણ નિયમો અનુસાર ટ્રાન્સફર કરવામાં આવશે. તે મુજબ, કંપનીએ તે શેરધારકોને વ્યક્તિગત સંદેશ મોકલ્યા છ જેમના શેર/ડિવિડન્ડ નાંણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨ ૬ દરમિયાન ઉપરોક્ત નિયમો હેઠળ IEPF ઓથોરિટીને ટ્રાન્સફર કરવા માટે જવાબદાર છે. કંપનીએ આવા શેરધારકો અને IEPF માં ટ્રાન્સફર કેરવા માટે બાકી રહેલા શેરની વિગતો તેની વેબસાઈટ www. voltamptransformers.com પર અપલોડ કરી છે. શેરધારકોને વિનંતી છે કે તેઅku IEPF ઓથોરિટીને ટ્રાન્સફર કરવા માટે જવાબદાર શેરની વિગતો ચકાસવા

|માટે કંપનીની વેબસાઇટનો સંદર્ભ લે. આ સંદર્ભમાં, કૃપા કરીને નીચેની બાબતોની નોંધ લોઃ

જો તમે ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવો છોઃ ડુપ્લિકેટ શેર પ્રમાણપત્ર(ઓ) જારી કરવામાં આવશે અને IEPF ને ટ્રાન્સફર કરવામાં આવશે. તમારા નામે નોંધાયેલ અને તમારી પાસે રહેલા મૂળ શેર પ્રમાણપત્ર(ઓ) આપમેળે રદ થઈ જશે.

જો તમે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શેર ધરાવો છોઃ તમારા ડીમેટ ખાતામાં થી (IEPF) ટ્રાન્સફર કરવા પાત્ર શેર ડીબીટ કરવામાં આવશે.

ત્રેંબંધિત શેરધારકોએ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં કંપની/રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ્સને ન ચૂકવાયેલા ડિવિડન્ડનો દાવો કરવા માટે અરજી કરવી. કુપા કરીને નોંધ લો કે જો ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં કંપની અથવા રજિસ્ટ્રારદ્વારા કોઈ જવાબ ન મળે તો, કંપનીને કોઈપણ સૂચના વિના, શેર IEPF ને ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવશે. એ પણ નોંધવું જોઈએ કે IEPF માં ટ્રાન્સફેર કરાયેલા શેર, આવા શેર પર ઉપાર્જિત થૂતા તમામ લાભો, જો કોઈ હોય તો, IEPF નિયમો દ્વારા નિર્ધારિત પ્રક્રિયા અનુસારેંઈંદ્ધ ઓથોરિટી પાસેથી પાછા મેળવવાનો દાવો કરી શકાય છે.

આ બાબતે કોઈપણ સ્પષ્ટતા માટે, કૃપા કરીને કંપનીના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ્સનો સંપર્ક કરોઃ મેસર્સ રેંદ્ધય્ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (અગાઉ મેસર્સ લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતું હતું), ગીતાકુંજ, ૧ ભકતિ નગર સોસાયટી એબીએસ ટૉવર પાછળ, ઓલ્ડ પાદરા રોડ,

વડોદરા-૩૯૦૦૧૫,ટેલિફોન નંબર:૦૨૭૫-૩૫૯૯૭૯૮ ઈ-મેઈલ: iepf. shares@linkintime.co.in.

વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લિમિટેડ વતી

સ્થળઃ વડોદરા તારીખઃ ૧૪ મે, ૨૦૨૫

કંપની સચિવ અને અનુપાલન અધિકારી

Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as on 31st March Farnings Per Share (Face Value of ₹ 10/- each) (for continuing and discontinued operations)

Total Income from operations

Net Profit / (Loss) for the period

Net Profit / (Loss) for the period before tax

Net Profit / (Loss) for the period after tax

Comprehensive Income (after tax)]

(after Exceptional and / or Extraordinary items)

atter Exceptional and / or Extraordinary items

[Comprising Profit / (Loss) for the period (after tax) and other

Total Comprehensive Income for the period

Particulars

62.23 60.97 Basic and Diluted (in ₹) The said Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 14th May, 2025.

Additional information on Standalone financial results is as follows

₹ in crore **Particulars** Quarter ended Year ended 31.03.2025 31.03.2024 31.03.2025 31.03.2024 Audited Audited Audited Audited 4.980.63 4.225.59 17.552.26 15,109.28 Total Income from Operations Profit before tax 332.47 322.30 1,072.82 1,099.41 Profit for the period 244.27 238.44 793.67 823.28 Total Comprehensive income (after tax) 258.05 798.56 214.16 802.33

The above is an extract of the detailed format of Statement of standalone and consolidated financial results filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of standalone and consolidated financial results are available on the Stock Exchange websites www.bseindia.com (Scrip Code - 532259) and www.nseindia.com (Scrip Symbol - APARINDS) and on Company's website at the weblink: https://apar.com/wp-content/uploads/2025/05/Outcome-of-Board-Meeting_Results-

The same can be accessed by scanning the QR Code provided below 具線線線具

For APAR Industries Limited Sd/-Kushal N. Desai **Chairman & Managing Director** DIN: 00008084

₹ in crore

31.03.2024

Audited

16.152.98

1,106.46

1.105.85

806.14

3,836.26

212.10

40.17

INTEGRA ENGINEERING INDIA LIMITED

CIN: L29199GJ1981PLC028741

Registered Office: Chandrapura Village, Tal. Halol-389 350, Dist. Panchmahals, Gujarat. Tel. No.: +91 90999 18471, Fax No.: +91-2676-220887, **Email ID**: info@integraengineering.in **Website**: www.integraengineering.in

Statem	Statement of Audited Standalone Financial Results for the Quarter and Year ended 31st March, 2025 (₹ in Lakhs)							
Sr. No.	Particulars	Quarter ended 31.03.2025	Year ended 31.03.2025	Quarter ended 31.03.2024				
1	Total income from operations	4,286.88	16,680.78	3,363.36				
2	Net Profit / (Loss) for the period before Tax	592.97	2,639.51	383.54				
3	Net Profit / (Loss) for the period after Tax	413.11	1,848.77	269,52				
4	Total Comprehensive Income for the period	403.75	1,843.56	276.03				
5	Equity Share Capital	343.95	343.95	343.65				
6	Other Equity	-	_	_				
7	Earnings per share of ₹ 1/- each							
	(1) Basic	1.20	5.38	0.78				
I	(2) Diluted	1 20	F 20	0.70				

Note: 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company's website (www.integraengineering.in) and on Stock Exchange website (www.bseindia.com), 2. The same can be accessed by scanning the QR Code provided below.

Place: Halol Date: 14.05.2025



For INTEGRA Engineering India Limited Jayesh Mehta Director

DIN: 10529297

ENGINEERING

Place : Mumbai

Date: 14th May, 2025

સંકેત રાઠોડ

INTEGRA ENGINEERING INDIA LIMITED

CIN: L29199GJ1981PLC028741

Registered Office: Chandrapura Village, Tal. Halol-389 350, Dist. Panchmahals, Gujarat. Tel. No.: +91 90999 18471, Fax No.: +91-2676-220887, **Email ID**: info@integraengineering.in **Website**: www.integraengineering.in

Statement of Audited Consolidated Financial Results for the Quarter and Year ended 31st March, 2025 (₹ in Lakhs) Quarter ended Quarter ended Year ended 31.03.2025 31.03.2025 31,03,2024 Total income from operations 4,286.88 16,680.78 592.97 2,639.51 383.54 Net Profit / (Loss) for the period before Tax Net Profit / (Loss) for the period after Tax 1.848.77 413.11 269.52 1 843 56 276.03 Total Comprehensive Income for the period 403 75 5 **Equity Share Capital** 343.95 343,95 343.65 Other Equity Earnings per share of ₹ 1/- each 1.20 5.38 0.78 (1) Basic (2) Diluted 1.20 5.38 0.78

Note: 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company's website (www.integraengineering.in) and on Stock Exchange website (www.bseindia.com).

2. The same can be accessed by scanning the QR Code provided below.

For INTEGRA Engineering India Limited Jayesh Mehta Director DIN: 10529297

Place: Halol Date: 14.05.2025